

B.Ed. Semester - 4 (CBCS) Examination
August/September -2020 [NEW COURSE]
G-1 Accounting (Ssc - 5)

Time: 1:00 Hours

Marks: 28

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ચાર પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. (૦૪)

- (1) પાઘડી એટલે શું?
- (2) મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર લખો.
- (3) સ્થિર(કાયમી)મૂડી ખાતાની પદ્ધતિ એટલે શું?
- (4) રોકડ વ્યવહાર હોય પરંતુ રોકડ પ્રવાહ ન હોય તેવું ઉદાહરણ આપો.
- (5) ભાગીદારી કરારનામાની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી કોઈ પણ બે જોગવાઈઓ જણાવો.

પ્રશ્ન.૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ૦૪ પ્રશ્નોના જવાબ લખો. (૬ માંથી ૪) (૦૮)

- (1) જયેશ, સુરેશ અને મહેશની પેઢીની માહિતી નીચે મુજબ છે. તેના આધારે છેલ્લાં પાંચ વર્ષના સરેરાશ નફા અનુસાર પાઘડીનું મૂલ્ય નક્કી કરો.

વર્ષ	નફો (₹)
૨૦૧૩-૧૪	૭૦૦૦૦
૨૦૧૪-૧૫	૧૧૦૦૦૦
૨૦૧૫-૧૬	૧૨૦૦૦૦
૨૦૧૬-૧૭	૮૦૦૦૦
૨૦૧૭-૧૮	૧૪૦૦૦૦

- (2) નાણાકીય વિશ્લેષણ એટલે શું ?
- (3) કાયો નફાનો ગુણોત્તર નક્કી કરો
 - (i) વેચાણ ₹ ૧૦,૦૦,૦૦૦, કાયો નફો ₹ ૩,૦૦,૦૦૦
 - (ii) વેચાણ ₹ ૧૫,૦૦,૦૦૦, વેચાણ માલની પડતર ₹ ૧૨,૦૦,૦૦૦
- (4) ઉપાડ પર વ્યાજની આમનોંધ લખો.
- (5) બિનરોકડ વ્યવહારો કયા છે? કોઈ પણ બે ઉદાહરણ લખો.
- (6) રોકડ પ્રવાહ પત્રકમાં બોનસ શેરની અસર સમજાવો.

પ્રશ્ન.૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ૦૪ પ્રશ્નોના જવાબ લખો. (૬ માંથી ૪) (૧૬)

- (1) નફાનુકસાન ખાતું અને નફાનુકસાન ફાળવણી ખાતાનો તફાવત સમજાવો.
- (2) ઇક્વિટી શેર ફાળવણીના સોપાનોની ચર્ચા કરો.
- (3) નાણાકીય વિશ્લેષણની મર્યાદાઓ વિશે નોંધ લખો.
- (4) ટૂંકનોંધ લખો : ભાગીદારીનું કરારનામું
- (5) પાઘડી મૂલ્યાંકનની પદ્ધતિઓ સમજાવો.
- (6) ચાર સધ્ધરતા ગુણોત્તરના નામ આપો.

ENGLISH VERSION

Q.1 Answer the following questions (04)

1. What is Goodwill?
2. Write down the formula for capitalized profit.
3. What is fixed capital account method?
4. Give illustration of cash transaction which is not cash flow
5. Point out any two provisions of partnership deed which can affect accounts of firm.

Q.2 Answer any four (04) questions from the following (6 out of 4) (08)

1. The details of Jayesh, Suresh and Mahesh firm is as under. Determine the value of goodwill on the basis on average profit of last five years.

Year	Profit (₹)
2013-14	70000
2014-15	110000
2015-16	120000
2016-17	90000
2017-18	140000

2. What is financial analysis?
3. Determine the gross profit ratio.
 - (i) Sales ₹ 10,00,000, Gross Profit ₹ 3,00,000
 - (ii) Sales ₹ 15,00,000 Cost of goods Sold ₹ 12,00,000
4. Pass a journal for interest on drawings.
5. What are non cash transactions? Give two examples.
6. Explain the effect of bonus share in cash flow statement.

Q.3 Answer any four (04) questions from the following (6 out of 4) (16)

1. Explain the difference between profit and loss account and profit-loss appropriation account.
2. Discuss about the steps for issue of equity shares.
3. Discuss about limitations of financial analysis.
4. Write a Short note: Partnership Deed
5. Explain the methods of evaluation of goodwill.
6. Name of the four Viability Ratios.
